

# Lev

## Chapter 12

Gujarati Interlinear

Reference: American Standard Version

1 וַיְדַבֵּר יְהוָה אֶל-מֹשֶׁה לֵאמֹר:  
અને-બોલ્યા યહોવા અલ-મૂસાને લામ્ઓર:  
[H0559](#) [H4872](#) [H0413](#) [H3068](#) [H1696](#)

And Jehovah spake unto Moses, saying,

2 וַיְדַבֵּר אֲשֶׁה לְאִמֶּךָ יִשְׂרָאֵל בְּנֵי אֶל-בְּיֹמֵי שְׁבַע יָמֵי טִמְאַתְהָ  
બોલ આશ્હ લામ્ઓર યિસ્રાએલ બની અલ-બની યોમો સ્શ્બ્શ્ત યોમો તિમ્ઓત્હા  
પુત્રને અને-જન્મ-આપે ગર્ભવતી-થાય જો રૂઝી કહેતાં ઈસ્રાએલના પુત્રોને — બોલ  
[H2145](#) [H3205](#) [H2232](#) [H0802](#) [H0559](#) [H3478](#) [H0413](#) [H1696](#)  
તિમ્ઓત્હા-રહેશે જોત્હા તેની-બીમારીના નદત માસિક-ધર્મના કિમ્ઓ જોમ-દિવસો યોમો દિવસ સાત તો-અશુદ્ધ-રહેશે  
[H1738](#) [H5079](#) [H3117](#) [H3117](#) [H7651](#)

Speak unto the children of Israel, saying, If a woman conceive seed, and bear a man-child, then she shall be unclean seven days; as in the days of the impurity of her sickness shall she be unclean.

3 וּבְיָמֵי הַשְּׁמִינִי יִמּוֹל בְּשָׂרָהּ יִמּוֹל יְמֹול בְּשָׂרָהּ  
અને-દિવસે આઠમા સુન્નત-કરાશે માંસ સુન્નત-કરાશે  
[H6190](#) [H1320](#) [H8066](#) [H3117](#)

And in the eighth day the flesh of his foreskin shall be circumcised.

4 וּשְׁלֹשִׁים יוֹם וּשְׁלֹשָׁת יָמִים יִנָּשֵׁב רֹחֵשׁ יָמִים  
અને-ત્રીસ દિવસ અને-ત્રણ દિવસ યોમો યોમો  
અને-ત્રીસ દિવસ અને-ત્રણ દિવસ યોમો યોમો  
[H5060](#) [H3808](#) [H6944](#) [H3605](#) [H2893](#) [H1818](#) [H3427](#) [H3117](#) [H7969](#) [H3117](#) [H7970](#)  
અને-ત્રીસ દિવસ અને-ત્રણ દિવસ યોમો યોમો  
અને-ત્રીસ દિવસ અને-ત્રણ દિવસ યોમો યોમો  
[H2893](#) [H3117](#) [H4390](#) [H5704](#) [H0935](#) [H3808](#) [H4720](#) [H0413](#)

And she shall continue in the blood of her purifying three and thirty days; she shall touch no hallowed thing, nor come into the sanctuary, until the days of her purifying be fulfilled.

5 וְאִם-נִקְבְּהָ נַקְבָּהָ תֵּלֵד וְטִמְאַתָּה שְׁבַע יָמִים  
અને-જો નકબ્હા નકબ્હા તોલ્દ યોમો  
અને-જો નકબ્હા નકબ્હા તોલ્દ યોમો  
[H3117](#) [H8337](#) [H3117](#) [H8346](#) [H5079](#) [H7620](#) [H3205](#) [H5347](#)  
અને-જો નકબ્હા નકબ્હા તોલ્દ યોમો  
અને-જો નકબ્હા નકબ્હા તોલ્દ યોમો  
[H2893](#) [H1818](#) [H3427](#)

But if she bear a maid-child, then she shall be unclean two weeks, as in her impurity; and she shall continue in the blood of her purifying threescore and six days.

שָׁנָתוֹ — H8141	בֶּן એક-વર્ષનું H8141	כֶּבֶשׂ ઘેટું H3532	תָּבִיא લાવશે H0935	לִבְתּוֹ પુત્રી-માટે H1323	אֹן કે H1323	לְבִן પુત્ર-માટે H1323	טְהַרְהָ શુદ્ધિકરણના H2893	יָמֶי દિવસો H3117	וּבְמִלּוֹתָ અને-જયારે-પૂરા-થાય H4390	
אֶל- — H0413	מוֹעֵד મંડપના H4150	אֶל- મુલાકાતના H0168	פֶּתַח દ્વાર-આગળ H6607	אֶל- — H0413	לְחֻטָּאת પાપાર્પણ-માટે H0413	תָּר હોલું H8449	אֶז- કે H8449	יוֹנָה કબૂતરનું H3123	וּבֶן- અને-બચ્ચું H3123	לְעֹלָה દહનાર્પણ-માટે H3123

הַכֹּהֵן:

યાજ્ઞક-પાસે  
H3548

And when the days of her purifying are fulfilled, for a son, or for a daughter, she shall bring a lamb a year old for a burnt-offering, and a young pigeon, or a turtle-dove, for a sin-offering, unto the door of the tent of meeting, unto the priest:

זָאת આ H2063	דְּמִיָּה તેન-લોહીના H1818	מִמֶּקְדָּר ઐતમાંથી H4726	וְטָהַרְהָ અને-શુદ્ધ-થશે H2891	עֲלֶיהָ તેન-માટે H2891	וְכִבָּר અને-પ્રાયશ્ચિત-કરશે H2891	יְהוָה યહોવાની H3068	לְפָנָי સમક્ષ H6440	וְהִקְרִיבֹ અને-ઘરાવશે H7126
			לְנִקְבָּה: પુત્રી-માટે H5347	אֹן કે H5347	לְזָכָר પુત્ર-માટે H2145	הַיְלֹדֶת જન્મ-આપનારીનો H3205	תּוֹרַת નિયમ-છે H8451	

and he shall offer it before Jehovah, and make atonement for her; and she shall be cleansed from the fountain of her blood. This is the law for her that beareth, whether a male or a female.

בְּנֵי બચ્ચાં H8147	שְׁנָיִם બે H8147	אֹן કે H8147	תְּרִים હોવાં H8449	שְׁתֵּי- બે H8147	וְלִקְחָהּ તો-લેશે H3947	שְׁהָ ઘેટું H7716	דְּבִי પૂરતું H1767	יָדָהּ તેનો-હાથ H3027	תְּמַצָּא પરવડે H4672	לֹא નહિ H3808	וְאִם- અને-જો H3808
פ — H2891	וְטָהַרְהָ: અને-શુદ્ધ-થશે H2891	הַכֹּהֵן યાજ્ઞક H3548	עֲלֶיהָ તેન-માટે H3548	וְכִבָּר અને-પ્રાયશ્ચિત-કરશે H3548	לְחֻטָּאת પાપાર્પણ-માટે H3548	וְאָחַד અને-એક H0259	לְעֹלָה દહનાર્પણ-માટે H0259	אֶחָד એક H0259	יוֹנָה કબૂતરનાં H3123		

And if her means suffice not for a lamb, then she shall take two turtle-doves, or two young pigeons; the one for a burnt-offering, and the other for a sin-offering: and the priest shall make atonement for her, and she shall be clean.